



Raj Bank

The Co-Operative Bank of Rajkot Ltd.

Multi State Co-Operative Bank

બોર્ડ/મીટીંગ તા. ૩૧.૦૮.૨૦૨૬ કરાવ નં. ૧૦ થી મંજૂર થયેલ તા. ૦૧.૦૯.૨૦૨૬ થી લાગુ પડતા ધિરાણનાં વ્યાજના દરો

Minimum Interest Rate on Advances - 08.00 %
Maximum Interest Rate on Advances - 13.00 %

Schedule of charges for Loan and Advances - 1

ક્રમ	ધિરાણનો પ્રકાર	ફ્લોટિંગ વ્યાજના દર (%)	ફિક્સ્ડ વ્યાજના દર (%)
૦૧	હોમ લોન (મહત્તમ મર્યાદા રૂ. ૨ કરોડ) CRA Score ૭૫૦ કે તેથી વધુ CRA Score ૭૦૦ થી ૭૪૯, -૧, No Score, ૧૦૦ થી ૩૦૦ CRA Score ૬૫૧ થી ૬૯૯ * બે કે તેથી વધુ એપ્લીકન્ટના કિસ્સામાં બધા એપ્લીકન્ટનો એવરેજ સ્કોર ગણવો. ** જો કોઈ એપ્લીકન્ટનો સ્કોર -૧ અથવા ૧૦૦ થી ૩૦૦ ની વચ્ચે હોય તો એવરેજ સ્કોર કરતી વખતે આ બંને સ્કોરને ધ્યાને લેવા નહિ.	સ્મોલ લોન લીમીટ સુધી સ્મોલ લોન લીમીટથી વધુ અને રૂ. ૨.૦૦ કરોડ સુધી ૮.૦૦ % ૮.૫૦ % ૯.૦૦ % ૮.૭૫ % ૯.૦૦ % ૯.૫૦ %	૧૦.૦૦ %
૦૨	હોમ લોન ટોપ અપ (મહત્તમ મર્યાદા રૂ. ૭૫ લાખ) CRA Score ૭૫૦ કે તેથી વધુ CRA Score ૭૦૦ થી ૭૪૯, -૧, No Score, ૧૦૦ થી ૩૦૦ CRA Score ૬૫૧ થી ૬૯૯ * બે કે તેથી વધુ એપ્લીકન્ટના કિસ્સામાં બધા એપ્લીકન્ટનો એવરેજ સ્કોર ગણવો. ** જો કોઈ એપ્લીકન્ટનો સ્કોર -૧ અથવા ૧૦૦ થી ૩૦૦ ની વચ્ચે હોય તો એવરેજ સ્કોર કરતી વખતે આ બંને સ્કોરને ધ્યાને લેવા નહિ.	૯.૦૦ % ૯.૫૦ % ૧૦.૦૦ %	૧૧.૦૦ %
નોંધ : હોમ લોન તથા હોમ લોન ટોપ-અપ લોનનું કુલ એકસપોઝર રૂ. ૨ કરોડથી વધવું જોઈશે નહીં.			
૦૩	વ્યક્તિગત હેતુ માટે વાહન લોન (મહત્તમ મર્યાદા રૂ. ૫૦ લાખ) (રૂ. ૧૫ લાખથી વધુની વાહન લોનના કિસ્સામાં કોલેટરલ સિક્યુરીટી લેવી ફરજિયાત છે.) (અરજદાર કે બે જામીન પૈકી કોઈપણ એક બેંકના ઓછામાં ઓછા એક વર્ષ જૂના સભાસદ હોવા જોઈએ.) CRA Score ૮૦૦ કે તેથી વધુ CRA Score ૭૫૦ થી ૭૯૯ CRA Score ૭૦૦ થી ૭૪૯, -૧, No Score, ૧૦૦ થી ૩૦૦ CRA Score ૬૫૧ થી ૬૯૯ * બે કે તેથી વધુ એપ્લીકન્ટના કિસ્સામાં બધા એપ્લીકન્ટનો એવરેજ સ્કોર ગણવો. ** જો કોઈ એપ્લીકન્ટનો સ્કોર -૧ અથવા ૧૦૦ થી ૩૦૦ ની વચ્ચે હોય તો એવરેજ સ્કોર કરતી વખતે આ બંને સ્કોરને ધ્યાને લેવા નહિ.	૮.૨૫ % ૮.૫૦ % ૮.૭૫ % ૯.૨૫ %	૧૦.૦૦ %
૦૪	વ્યક્તિગત હેતુ માટે સ્માર્ટ કેડીટ લોન (Non Real Estate) (મહત્તમ મર્યાદા રૂ. ૨૫ લાખ)	---	૧૧.૦૦ %
૦૫	જાતજામીન લોન (મહત્તમ મર્યાદા રૂ. ૧ લાખ)	---	૧૩.૦૦ %
૦૬	માઈક્રો ફાઈનાન્સ લોન (મહત્તમ મર્યાદા રૂ. ૧ લાખ)	---	૧૩.૦૦ %
૦૭	ગોલ્ડ લોન ગોલ્ડ સામે ઓવરડ્રાફ્ટ (મહત્તમ મર્યાદા રૂ. ૧.૭૫ લાખ) (મહત્તમ મર્યાદા રૂ. ૧૦ લાખ)	---	૯.૫૦ %
૦૮	NSC / KVP / LIC પોલીસી સામે લોન / ઓડી	---	૯.૫૦ %
૦૯	FD સામે OD અને લોન ડીપોઝીટર માટે (રૂ. ૧૦ કરોડ કે તેથી વધુ OD/Loanની રકમ) ડીપોઝીટર માટે (રૂ. ૧૦ કરોડથી ઓછી OD/Loanની રકમ) થર્ડ પાર્ટી માટે * પ્રોગ્રાઈટર ફર્મ, પાર્ટનરશીપ ફર્મ, કંપની વગેરેને પ્રોગ્રાઈટર, પાર્ટનર અથવા ડિરેક્ટરના નામે રહેલી FD સામે મંજૂર કરવામાં આવેલ FDD ને 'થર્ડ પાર્ટી FD' તરીકે ગણવામાં આવશે નહીં અને ROI ઉપર જણાવ્યા મુજબ લાગુ પડશે.	---	એફડી રેટ+૦.૫૦% એફડી રેટ+૧.૦૦% એફડી રેટ+૨.૦૦%
૧૦	સ્ટાફ લોન	પોલીસી પ્રમાણે	

④ 'Sahakar Sarita', Panchnath Road, Rajkot - 360 001 (Gujarat)

① 0281 - 2234454 / 2224120

② Fax: 0281 - 2236682

③ info@tcbrl.bank.in

④ tcbrl.bank.in

①



Raj Bank

The Co-Operative Bank of Rajkot Ltd.

Multi State Co-Operative Bank

સ્મોલ લોન ધિરાણ માટે

ક્રમ	ધિરાણનો પ્રકાર	ફ્લોટિંગ વ્યાજના દર (%)
૧૧	- કેશ કેડીટ / સિક્યોર્ડ ઓવરડ્રાફ્ટ - કેશ કેડીટ/સિક્યોર્ડ ઓવરડ્રાફ્ટ એડહોક લીમીટ (સેક્શન લીમીટના ૨૫% સુધી) - બિઝનેસ લોન - મશીનરી લોન - ઇન્ડસ્ટ્રીયલ લોન - ફર્નીચર ફીક્સર લોન - સોલાર / રીન્યુએબલ એનર્જી લોન - લીઝ રેન્ટલ ડિસ્કાઉન્ટ લોન *નોંધ : નીચે દર્શાવેલ શરતોમાંથી કોઈપણ એક કે તેથી વધારે શરત પૂર્ણ હોય તો ઉપરોક્ત દર્શાવેલ તમામ પ્રોડક્ટમાં નવા ધિરાણમાં અને સીસી/ઓડીમાં રીન્યુઅલ સમયે દર્શાવેલ વ્યાજદરમાં ૦૦.૨૫%ની છૂટ મળવાપાત્ર રહેશે. - ઇમુવેબલ સિક્યોરીટી ૧૫૦% કે તેથી વધુ હોય. - એપ્લીકન્ટ કે તેના પ્રોપ્રાઇટર/પાર્ટનર/ડીરેક્ટરે બેંકમાંથી ધિરાણ લીધેલ હોય અને તેમાં છેલ્લા ૨ વર્ષ દરમિયાન ક્યારેય પણ ૧૦ દિવસથી વધારે ઓવરડ્યુ ન થયેલ હોય.	૮.૭૫ %*
૧૨	ધંધાકીય હેતુ માટે સ્માર્ટ કેડીટ લોન (Non Real Estate) (મહત્તમ મર્યાદા રૂા. ૧ કરોડ) *નોંધ : નીચે દર્શાવેલ શરતોમાંથી કોઈપણ એક કે તેથી વધુ શરત પૂર્ણ હોય તો નવા ધિરાણમાં વ્યાજદરમાં ૦૦.૨૫% ની છૂટ મળવાપાત્ર રહેશે. - સિક્યોરીટીનું માર્જિન ૫૦% કે તેથી વધુ હોય. - એપ્લીકન્ટે બેંકમાંથી ધિરાણ લીધેલ હોય અને તેમાં છેલ્લા ૨ વર્ષ દરમિયાન ક્યારેય પણ ૧૦ દિવસથી વધારે ઓવરડ્યુ ન થયેલ હોય. - પ્રોફેશનલી ક્વોલીફાઇડ એપ્લીકન્ટ માટે (જેમકે ડોક્ટર/સીએ/સીએસ/આઈસીડબલ્યુએ/આર્કિટેક વગેરે)	૧૦.૦૦ %*

પ્રોફેશનલ લોન / બિલ્ડર લોન ધિરાણ માટે

૧૩	ડોક્ટરો / હોસ્પિટલ માટે - ૧. મેડીકલ ઇક્વીપમેન્ટ (ઇન્સ્ટ્રુમેન્ટ માટે) ૨. બિઝનેસ લોન (હોસ્પિટલ બિલ્ડિંગ માટે) ૩. ફર્નીચર ફીક્સર લોન (હોસ્પિટલ માટે) * નોંધ : ઉપરોક્ત લોનમાં ઇમુવેબલ સિક્યોરીટી ૧૨૫% કે તેથી વધુ હોય તો, નવું ધિરાણ આપતા સમયે દર્શાવેલ વ્યાજદરમાં ૦.૨૫% ની છૂટ મળવાપાત્ર રહેશે.	૮.૫૦ %*
૧૪	બિલ્ડર કોન્ટ્રાક્ટરને કન્સ્ટ્રક્શન કરવા માટે ધિરાણ	૧૨.૫૦ %

કેડીટ રેટીંગ શીટના આધાર માટે

ક્રમ	ધિરાણનો પ્રકાર	ગ્રેડ	ફ્લોટિંગ વ્યાજના દર (%)
૧૫	- કેશકેડીટ અથવા સિક્યોર્ડ ઓવરડ્રાફ્ટ (બિઝનેસ માટે) - સીસી/એસઓડી/એડહોક લીમીટ એક્સ્પોઝર લીમીટની મર્યાદામાં (સેક્શન લીમીટના ૨૫% સુધી) - બિઝનેસ લોન - મશીનરી લોન - સોલાર / રીન્યુએબલ એનર્જી લોન - ઇન્ડસ્ટ્રીયલ લોન - ફર્નીચર ફીક્સર લોન - લીઝ રેન્ટલ ડિસ્કાઉન્ટ (Lease Rental Discount)	Grade- A+ Grade- A Grade- B+ Grade- B Grade- C+ Grade- C Grade- D+ Grade- D	૦૮.૫૦ % ૦૮.૭૫ % ૦૯.૦૦ % ૦૯.૨૫ % ૦૯.૫૦ % ૦૯.૭૫ % ૧૦.૦૦ % ૧૦.૨૫ %

નોંધ

- કોઈપણ ધિરાણની ચુકવણી કરતા પહેલા પ્રાથમિક દરખાસ્ત તથા તમામ પ્રકારના ડોક્યુમેન્ટ મેળવી મોર્ટગેજ રજીસ્ટર કરાવી અને ફાઇલ પૂર્ણ કર્યા બાદ જ ધિરાણની ચુકવણી કરવી. ખાસ કીસ્સામાં મોર્ટગેજ ધિરાણની ચુકવણી કર્યા બાદ કરવાનું હોય ત્યારે સેન્ટ્રલાઈઝડ ધિરાણ વિભાગની પરમીશન લેવી. આ પ્રકારના કિસ્સામાં ધિરાણ ચુકવ્યાના મહત્તમ ૧ (એક) માસના સમયમાં મોર્ટગેજ રજીસ્ટર કરાવવાનું ફરજિયાત રહેશે.
- ધિરાણના વ્યાજના દરના સરકયુલરના અર્થઘટનનો મુદ્દા ઉપસ્થિત થાય ત્યારે બોર્ડ ઓફ ડીરેક્ટર્સ / લોન એન્ડ રીકવરી કમીટી દ્વારા કરેલ નિર્ણય આખરી ગણવામાં આવશે અને નક્કી કરેલા વ્યાજના દરમાં ફેરફાર કરવાના પણ અધિકાર બોર્ડ ઓફ ડીરેક્ટર્સ / લોન એન્ડ રીકવરી કમીટી પાસે રહેશે.

© 'Sahakar Sarita', Panchnath Road, Rajkot - 360 001 (Gujarat)

☎ 0281 - 2234454 / 2224120

☎ Fax: 0281 - 2236682

✉ info@tcbrl.bank.in

🌐 tcbrl.bank.in

૨



The Co-Operative Bank of Rajkot Ltd.

Multi State Co-Operative Bank

**ધિરાણ માટે માર્જન તથા
પ્રોસેસ ચાર્જ / કમિશન**

ક્રમ	ધિરાણનો પ્રકાર	મીનીમમ માર્જન (%)	પ્રોસેસ ચાર્જ (%)
૦૧	હોમ લોન (મહત્તમ મર્યાદા રૂ. ૨ કરોડ)	૨૦ %	રૂ. ૭૫ લાખ સુધી ૦૦.૫૦% + GST રૂ. ૭૫ લાખથી ઉપર ૦૦.૪૦% + GST
૦૨	હોમ લોન ટોપ અપ (મહત્તમ મર્યાદા રૂ. ૭૫ લાખ)	૨૦ %	૦૦.૫૦% + GST
૦૩	વ્યક્તિગત હેતુ માટે વાહન લોન (મહત્તમ મર્યાદા રૂ. ૫૦ લાખ)	૨૦ %	૦૦.૫૦% + GST
૦૪	વ્યક્તિગત હેતુ માટે સ્માર્ટ કેડીટ લોન (Non Real Estate) (મહત્તમ મર્યાદા રૂ. ૨૫ લાખ)	૫૦ %	૦૦.૫૦% + GST
૦૫	જાતજામીન લોન (મહત્તમ મર્યાદા રૂ. ૧ લાખ)	---	૦૦.૫૦% + GST
૦૬	માઈક્રો ફાઈનાન્સ લોન (મહત્તમ મર્યાદા રૂ. ૧ લાખ)	સ્કીમ મુજબ	૦૦.૨૫% + GST
૦૭	ગોલ્ડ લોન (મહત્તમ મર્યાદા રૂ. ૧.૭૫ લાખ)	૩૦ %	---
	ગોલ્ડ સામે ઓવરડ્રાફ્ટ (મહત્તમ મર્યાદા રૂ. ૧૦ લાખ)		
૦૮	NSC / KVP / LIC પોલીસી સામે લોન / ઓડી	૨૦ %	૦૦.૫૦% + GST
૦૯	એફડી સામે ઓડી અને લોન (ડીપોઝીટર તથા થર્ડ પાર્ટી માટે)	૧૦ %	---
૧૦	સ્ટાફ લોન	પોલીસી પ્રમાણે	

સ્મોલ લોન ધિરાણ

૧૧	- કેશ કેડીટ / સિક્યોર્ડ ઓવરડ્રાફ્ટ *તા. ૦૧.૦૬.૨૦૨૫ પહેલા મંજૂર થયેલ અને હવે રીન્યુ થતી એસઓડી માટે મીનીમમ માર્જન ૧૦% રહેશે. (૧ વર્ષ પૂર્ણ થયે રીન્યુઅલ વખતે જે પ્રોસેસ ચાર્જ અમલમાં હશે તે લાગુ પડશે.) - કેશ કેડીટ/સિક્યોર્ડ ઓવરડ્રાફ્ટ એડહોક લીમીટ (સેક્શન લીમીટના ૨૫% સુધી)	કેશ કેડીટ ૨૫ % સિક્યોર્ડ ઓડી ૨૦ %*	૦૦.૫૦% + GST રીન્યુઅલ ચાર્જ ૦૦.૨૫%+GST એડહોક લીમીટના પ્રોરેટા ૦૦.૫૦% + GST
	- બિઝનેસ લોન - મશીનરી લોન - સોલાર/રીન્યુએબલ એનર્જી લોન - લીઝ રેન્ટલ ડિસ્કાઉન્ટ લોન	- ઇન્ડસ્ટ્રીયલ લોન - ફર્નીચર ફીક્સર લોન	૨૦ % ૦૦.૫૦% + GST
		૩૦ %	૦૦.૫૦% + GST
૧૨	ધંધાકીય હેતુ માટે સ્માર્ટ કેડીટ લોન (Non Real Estate)(મહત્તમ મર્યાદા રૂ. ૧ કરોડ)	૪૦ %	૦૦.૫૦% + GST

પ્રોફેશનલ લોન / બિલ્ડર લોન ધિરાણ માટે

૧૩	ડોક્ટરો / હોસ્પિટલ માટે - ૧. મેડીકલ ઇક્વિપમેન્ટ (ઇન્સ્ટ્રુમેન્ટ માટે) ૨. બિઝનેસ લોન (હોસ્પિટલ બિલ્ડિંગ માટે) ૩. ફર્નીચર ફીક્સર લોન (હોસ્પિટલ માટે)	૨૦ %	૦૦.૨૫% + GST
૧૪	બિલ્ડર કોન્ટ્રાક્ટરને કન્સ્ટ્રક્શન કરવા માટે ધિરાણ (૧ વર્ષ પૂર્ણ થયે રીન્યુઅલ વખતે જે પ્રોસેસ ચાર્જ અમલમાં હશે તે લાગુ પડશે.)	૩૦ %	૦૧.૦૦% + GST રીન્યુઅલ ચાર્જ ૦૦.૫૦%+GST

કેડીટ રેટીંગ શીટના આધાર માટે

૧૫	- કેશકેડીટ અથવા સિક્યોર્ડ ઓવરડ્રાફ્ટ (બિઝનેસ માટે) *તા. ૦૧.૦૬.૨૦૨૫ પહેલા મંજૂર થયેલ અને હવે રીન્યુ થતી એસઓડી માટે મીનીમમ માર્જન ૧૦% રહેશે. (૧ વર્ષ પૂર્ણ થયે રીન્યુઅલ વખતે જે પ્રોસેસ ચાર્જ અમલમાં હશે તે લાગુ પડશે.) - સીસી/એસઓડી/એડહોક લીમીટ એક્સ્પોઝર લીમીટની મર્યાદામાં (સેક્શન લીમીટના ૨૫% સુધી)	કેશ કેડીટ ૨૫ % સિક્યોર્ડ ઓડી ૨૦ %*	૦૦.૫૦% + GST રીન્યુઅલ ચાર્જ ૦૦.૫૦%+GST એડહોક લીમીટના પ્રોરેટા ૦૦.૫૦% + GST
	- બિઝનેસ લોન - મશીનરી લોન - સોલાર / રીન્યુએબલ એનર્જી લોન - લીઝ રેન્ટલ ડિસ્કાઉન્ટ (Lease Rental Discount)	- ઇન્ડસ્ટ્રીયલ લોન - ફર્નીચર ફીક્સર લોન	૨૦ % ૦૦.૫૦% + GST
		૩૦ %	૦૦.૫૦% + GST

નોન-ફંડ ધિરાણ માટે

૧૬	LC / BG (કેશ માર્જન)	૨૫ %	કમિશન - ૦૧.૦૦% + GST
----	----------------------	------	----------------------

નોંધ : પ્રોસેસ ચાર્જમાં ફેરફાર કરવાની સત્તા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ / લોન એન્ડ રીકવરી કમીટીની રહેશે.

સ્થળ : રાજકોટ

તારીખ : ૦૧.૦૬.૨૦૨૬



(Signature)
જુલી સાવલીયા
ચીફ એક્ઝિક્યુટીવ ઓફીસર



The Co-Operative Bank of Rajkot Ltd.

Raj Bank

Multi State Co-Operative Bank

Schedule of charges for Loan and Advances - 2

w.e.f. 01.09.2026

01. Pre-payment Charges (applicable for Loan Sanction Amount - more than Rs. 50 Lacs)

1.1	Frequency of Charges	At the time of take over of A/c.	
1.2	Parameters for charges	Outstanding balance at the time of take over of account (નોંધ : CC/OD ના કિસ્સામાં સેક્શન લીમીટથી વધુ રકમ પર ચાર્જ લઈ શકાશે નહીં.)	
1.3	Charges	CC/OD Account	0.50%
		In Term Loan Account	0.50%
		(Max. Charges Rs, 10,00,000/-)	

નોંધ

- ઉપરોક્ત ચાર્જસ તા. ૦૧.૦૪.૨૦૨૪થી અમલમાં છે. તેથી તા. ૦૧.૦૪.૨૦૨૪ કે તે પછી મંજૂર થતી લોન કે રીન્યુ થતી CC/OD જેના કરાર પત્ર / સેક્શન લેટરમાં ઉપરોક્ત ચાર્જસ અંગેનો ઉલ્લેખ કરેલ હશે તેમાં જ પ્રિ-પેમેન્ટ ચાર્જ લઈ શકાશે તેથી, કોઈ પણ ખાતામાં પ્રિ-પેમેન્ટ ચાર્જ લેતાં પહેલાં તે ખાતાનાં કરાર પત્ર અને સેક્શન લેટર અને KFS માં પ્રિ-પેમેન્ટ ચાર્જસ અંગેનો ઉલ્લેખ થઈ ગયેલ છે તેની ખાસ ચકાસણી કરી લેવી.
- નીચે જણાવેલ કિસ્સામાં ઉપરોક્ત ચાર્જ લઈ શકાશે નહીં, જેની નોંધ લેશો.
 - જ્યારે ધીરાણદાર પોતાના ફંડથી ધીરાણ ખાતુ ભરપાઈ કરે તેવા કિસ્સામાં
 - રૂ. ૨૫,૦૦૦/- સુધીની પ્રાયોરીટી સેક્ટરને લગતી લોન ખાતાઓ
 - માઈક્રોફાઈનાન્સ લોન ખાતાઓ
 - કોઈપણ વ્યક્તિ કે MSME એકમને ધંધાકીય હેતુ માટે આપેલ રૂ. ૫૦.૦૦ લાખ સુધીની લોન ખાતાઓ
 - CC/OD ના કિસ્સામાં જો ધીરાણદાર CC/OD રીન્યુ ન કરવા કે CC/OD ભરપાઈ કરવાના ઇરાદાની જાણ બેંકને કરે તો તેવા કિસ્સામાં (કોઈપણ CC/OD ના કરારમાં ઉપર મુજબની બાબતનો ઉલ્લેખ કરેલ છે કે નહિ તેની ખાસ ચકાસણી કરવી.)
 - RBI ના Circular No. DoR.MCS.REC. No. 211/01-01-037/2025-26 Dated 28, November-2025 મુજબ કોઈપણ વ્યક્તિગતના નામે આપેલ વ્યક્તિગત હેતુ માટેની લોન જેવી કે પર્સનલ લોન, હોમ લોન, વ્હીકલ લોન વિગેરે ફ્લોટીંગ દરે આપેલ હોય, તો તેવા કિસ્સામાં
- ઉપરોક્ત ચાર્જમાં ફેરફાર કરવાની કે પરત કરવાની સત્તા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ / લોન અને રીકવરી કમીટીની રહેશે.



[Signature]

જુલી સાવલીયા

ચીફ એક્ઝિક્યુટીવ ઓફીસર

સ્થળ : રાજકોટ

તારીખ : ૦૧.૦૯.૨૦૨૬

① 'Sahakar Sarita', Panchnath Road, Rajkot - 360 001 (Gujarat)

② 0281 - 2234454 / 2224120

③ Fax: 0281 - 2236682

④ info@tcbrl.bank.in

⑤ tcbrl.bank.in

⑧